

-: રૂઠાની નુરખો :-

ઈમામ જાઅફરુસ્સાદિક (અ.સ.) થી રિવાયતમાં મન્દૂલ છે કે, ત્રણ ખસલતો એવી છે કે જે ભૂલવાની આદતને મીટાવી દે છે, અને યાદ રાખવાની કુવત પૈદા કરે છે. તે છે :

(૧) કુરઆનની કિરાત - તિલાવત કરવી (૨) દાતન કરવું (૩) રોઝા રાખવા.

આપ (અ.સ.) એ એમ પણ ફરમાવું છે કે, તુંને જે વક્ત હમ-ગમ, રંજો મલાલ પૈદા થાય તો તારા જમણા હાથને તારા સજદાની જગા પર મુકજે તે બાદ તારા હાથને તારા મોં પર તારા ડાબા ગાલની જાનિબથી તારી પૈશાની પર તે બાદ તારા જમણા ગાલની જાનિબ તક ફિરાવજે અને તે બાદ બિસ્મિલ્લાહ સાથે સૂરતુલ હશ્રની ૨૨ મી આયતની તિલાવત અને આ મિસિલ દોઆના કલેમાત પઢીશ તો અલ્લાહતઆલા તારા તમામ હમ-ગમ ને દૂર કરશે.

દોઆ :- બિસ્મિલ્લા હિર્રહમા નિર્રહીમ. બિસ્મિલ્લા હિલ્લઝી લા ઈલાહા ઈલ્લા હુવા આલેમુલ ગૈબે વશશહાદતે હુવર રહમાનુર રહીમ, અલ્લાહુમ્મઝહિબ અન્નિયલ હમ્મા વલ હઝના વલ ફેટના કુલ્લહા મા ઝહરા મિન્હા વમા બતન.

તરખુમો :- શુરૂ કરું છું હું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે. શુરૂ કરું છું હું અલ્લાહના નામથી કે જેના સિવાય કોઈ માઅબૂદ નથી. અલ્લાહ મખ્ફી અને ઝાહિરનો જાણનાર છે, તે અલ્લાહ રહમાન અને રહીમ છે. તું મારાથી હમ અને અંદોહ અને ફિત્તાને દૂર કરજે જે ઝાહિર હોય યા બાતિન તમામને દૂર કરજે. ★